



**Deep Energy**  
Resources Limited

16<sup>th</sup> February, 2024

To,  
**BSE Limited**  
Corporate Relations Department  
2<sup>nd</sup> Floor, P.J. Towers,  
Dalal Street,  
Mumbai-400 001

To,  
**National Stock Exchange of India Limited**  
Corporate Relations Department  
Exchange Plaza, Plot No. C-1, Block-G,  
Bandra Kurla Complex, Bandra (East),  
Mumbai – 400 051.

**Scrip Code : 532760**

**Symbol: DEEPENR**

**Sub.: Intimation of Newspaper Publications with respect to the dispatch of postal ballot notice pursuant to Regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.**

---

Respected Sir/Madam,

With reference to our letter dated 15<sup>th</sup> February, 2024 in relation to intimation of the postal ballot notice along with the explanatory statement ("Notice"), please find enclosed herewith the copies of the newspaper publication dated 16<sup>th</sup> February, 2024 published in the Business Standard (English) and Jai Hind (Gujarati), with regard to e-Voting information and completion of dispatch of Notice, in terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.


The advertisements may also be accessed on the website of the Company at [www.deepenergy.ooo](http://www.deepenergy.ooo).

You are requested to take the same on your records.

Thanking you,

Yours faithfully,

For, Deep Energy Resources Limited

  
Divyeshkumar Senjaliya  
Company Secretary & Compliance Officer  
Membership No.: A60456



Encl: as above

**DEEP ENERGY RESOURCES LIMITED**

(Formerly known as Deep Industries Limited)

Regd. Office Address : 12A & 14, Abhishree Corporate Park, Ambli-Bopal Road, Ambli, Ahmedabad-380 058.

Tel. : 02717-298510 Fax : +91 2717 298520 E-mail : [info@deepenergy.ooo](mailto:info@deepenergy.ooo) Website : [www.deepenergy.ooo](http://www.deepenergy.ooo)

CIN : L63090GJ1991PLC014833

Chola logo and Chola Real Estate logo with tagline 'Enter a better life'.

CHOLAMANDLAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002...

AUCTION SALE NOTICE
EDELWEISS ASSET RECONSTRUCTION COMPANY LIMITED

Regd. Office: Edelweiss House, 31st Floor, Off CST Road, Kalina, Mumbai 400098.
E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMovable SECURED ASSETS UNDER THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002...

WARDWORTH FOODS AND BEVERAGES LIMITED
(FORMERLY KNOWN AS VEGETABLE PRODUCTS LIMITED)

Table with columns: Sr. No., Particulars, Quarter ended 31-12-2023, Quarter ended 31-12-2022, Quarter ended 31-12-2021, Quarter ended 31-12-2020. Includes financial data for Total Income, Net Profit, and Total Comprehensive Income.

DETAILS OF SECURED ASSET PUT FOR E-AUCTION:

Table with columns: Loan Account Number, Borrower/Co-borrower/Guarantor/Mortgage name, Trust Name, Bank Details, Total Outstanding Amount as on 14.02.2024, Reserve Price (NR), EMD (NR), Date & Time of Auction, Type of Possession. Lists multiple secured assets with details.

Notes:

- 1. The Statement of Unaudited Standalone Financials for the Quarter Ended 31 December, 2023 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 14.02.2024.
2. These Financial Results have been prepared in accordance with the Indian Accounting Standard (Ind-AS) prescribed under Section 133 of the Company Act, 2013...

Important information regarding Auction Process:

- 1. All Demand Drafts (DD) shall be drawn in favor of Trust name as mentioned above and payable at Mumbai.
2. Last Date of Submission of EMD: Received 1 day prior to the date of auction.
3. Place for Submission of Bids: 1st Floor, Edelweiss House, off CST Road, Kalina, Mumbai-400098.

DEEP ENERGY RESOURCES LIMITED

Regd. Office: 12A & 12B, Abhinav Corporate Park, Anil Bopal Road, Ambli, Ahmedabad-380 058. Ph: 02717-298510; Fax: 02717-298520.
E-mail: info@deepenergy.co. Website: www.deepenergy.co

POSTAL BALLOT AND REMOTE-VOTING INFORMATION

Notice is hereby given that pursuant to Section 110 and Section 108 of the Companies Act, 2013 ("the Act") and all other applicable provisions, if any, of the Act together with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules") (including any modifications) and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("the SEBI Listing Regulations"), Deep Energy Resources Limited ("the Company") is seeking approval of its Member through Postal Ballot (Remote e-voting) for the resolutions as set out in the Postal Ballot notice dated 08th February, 2024. The Members are hereby informed that:

- 1. In compliance with all the applicable Circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and Securities and Exchange Board of India ("SEBI") the Postal Ballot Notice was sent only through electronic mode to those Members whose names are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories and whose e-mail addresses were registered with the Company/Depositories/RTA as on 08th February, 2024 being the cut-off date for the said purpose. The MCA has clarified that the companies are required to provide the remote e-voting facility under the Act, while they are transacting business only by postal ballot up to 30th September, 2024 and the requirements as provided in Rule 20 of the Rules as well as the framework provided in the MCA circulars issued from time to time apply mutatis mutandis.
2. The Postal Ballot Notice, Explanatory Statement along with the remote e-voting instructions, has been sent by the Company for seeking consent of the Members on the resolutions as set out in the postal ballot notice only through electronic mode on 15th February, 2024 to all those Members whose e-mail addresses were registered with the Company/Depositories/RTA as on Friday, 08th February, 2024 which was also the cut off date to reckon the paid up value of shares and voting rights of the members.
3. The Postal Ballot notice is also available on the Company's website (www.deepenergy.co), website of Central Depository Services (India) Limited (CDSL) (www.evotingindia.com) and the website of the stock exchange where the equity shares of the Company are listed i.e. BSE Limited (BSE) (www.bseindia.com) and National Stock Exchange of India Limited (NSE) (www.nseindia.com). The Company has engaged the services of CDSL for providing the remote e-voting facility.
4. The remote e-voting period will commence from Saturday, 17th February, 2024 at 8:00 hours (IST) and ends on Sunday, 17th March, 2024 at 17:00 hours (IST). During this period the shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. Friday, 08th February, 2024 are requested to cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter.
5. The Members who have not registered their e-mail addresses and in consequence of which the Notice on Postal Ballot and remote e-voting instructions could not be serviced may temporarily register their e-mail addresses registered with the Company or RTA by clicking the below link: https://linkintime.co.in/EmailReg/Email\_Register.html. Members are requested to follow the process as guided to capture the e-mail address and mobile number for obtaining the soft copy of the notice of postal ballot along with USER ID and Password.
6. The Board of Directors of the Company through board resolution passed on 08th February, 2024 has appointed Mr. Rutech Chokshi (Membership No. FCS 117584) Practising Company Secretary, as the Scrutinizer to scrutinize the postal ballot through remote e-voting process in a fair and transparent manner.
7. The result of the postal ballot will be announced on or before two working days from the conclusion of the meeting. The said results along with the Scrutinizer's report would be intimated to BSE and NSE and will also be uploaded on the Company's website and on the website of CDSL. The resolution if passed by requisite majority shall be deemed to have been passed on the last date specified by the Company for remote e-voting i.e. Sunday, 17th March, 2024 at 17:00 PM IST.
8. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rutech Dali, Sr. Manager, (DSE) at Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Towers, Marfatil Mill Compounds, N.M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call at toll free No. 1800 225 533.

Edelweiss Asset Reconstruction logo and contact information.

How to Meet Decision Makers without an Appointment. Includes a large image of a person and text about business standard.

Grow your business with Business Standard - the smart choice to reach those who matter!

- 71% readers in NCCS A1 and A2
12 English, 6 Hindi editions: 1000+ towns
6 lakh registered users, 12 million unique visitors per month
Print readers spend >15 min per day, digital >5 min per visit
The most-read business medium in top 3-B schools
150+ events every year

Write to sales@bsmail.in now, for a customised solution to your business requirements

Business Standard Insight Out logo and contact information.

Table with columns: Sr. No., Name of Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s) / Heirs, Loan Account No., Details of the Secured Asset, Amount Outstanding, Reserve Price, Date and Time of Auction, Date of Auction. Lists multiple secured assets.

Notice for sale of immovable assets

All interested parties/bidders are requested to visit the website https://www.auctionfocus.in/chola-36 and https://www.cholamandlam.com. For details, help, procedure and online bidding on auction, prospective bidders may contact M/s. Auction Focus Private Limited...

This is also a Statutory 30 days Sale Notice Under Rule 9 (1) of the Auction Focus (Enforcement) Rules, 2002

Date: 16.02.2024, Place: JUNGADH. Sd/- Auction Focus Investment and Finance Company Limited

Icici Home Finance logo and contact information.

Corporate Office: ICICI Home Finance Company Limited ICICI Home Finance (India) Private Limited, Andheri - Kurva Road, Andheri (East), Mumbai - 400059, India

Notice for sale of immovable assets

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest Act, 2002...

Table with columns: Sr. No., Name of Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s) / Heirs, Loan Account No., Details of the Secured Asset, Amount Outstanding, Reserve Price, Date and Time of Auction, Date of Auction. Lists multiple secured assets.

The online auction will be conducted on website (URL Link: https://BestAuctionDeal.com) of our auction agency Globe Tech. The mortgagee's notice are given a last chance to pay the total dues with further interest till March 04, 2024 before 05:00 PM...

For any further clarifications with regards to inspection, terms and conditions of the auction or submission of the bid, kindly contact ICICI Home Finance Company Limited on 9928087300 or our Sales & Marketing Partner NexSen Solutions Private Limited.

Date: 16 February 16, 2024. Place: Kutich. ICICI Home Finance Company Limited

Hiraniandani Financial Services Private Limited logo and contact information.

Regd. Office: 514, Dalamba Towers, 211 Free Press Marg, Nariman Point, Mumbai-400021. Corporate Office: 9th Floor, Signet Towers Park, Panchsheel Park, Andheri West, Mumbai-400076.

APPENDIX - I/VA (See proviso to rule 8 (1) and 9 (1)) SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest Act, 2002...

Table with columns: Sr. No., 1. Borrower's Name, 2. Loan Account Number, 3. Outstanding Amount, Description of the Mortgaged Property, 1. Date & Time of Auction, 2. Last Date of Submission of Emd, 3. Date & Time of the Property Inspection, 1. Reserve Price, 2. EMD of the Property, 3. Incremental Value. Lists multiple secured assets.

For detailed terms and conditions of the sale, please refer to the link provided in Hiraniandani Financial Services Pvt. Limited Secured Creditor's website i.e. (www.hfs.in)

TERMS & CONDITIONS OF ONLINE E-AUCTION SALE: As such sale is without any kind of warranties & indemnities. Particulars of the proposed sale, including all measurements specified in the E-Auction Sale Notice has been stated to the best of information of the Secured Creditor and Secured Creditor shall not be answerable for any error, misstatement or omission. Auction Extant & dimensions may differ.

- 1. The Property is being sold on "AS IS WHERE IS, WHAT IS, WITHOUT RESERVE BASIS". As such sale is without any kind of warranties & indemnities.
2. Particulars of the proposed sale, including all measurements specified in the E-Auction Sale Notice has been stated to the best of information of the Secured Creditor and Secured Creditor shall not be answerable for any error, misstatement or omission.
3. Auction Extant & dimensions may differ.
4. The E-Auction Sale Notice issued by the Secured Creditor is an invitation to the general public to submit their bids and the same does not constitute and will not be deemed to constitute any commitment or any representation on the part of the Secured Creditor. The E-Auction Sale Notice issued by the Secured Creditor is an invitation to the general public to submit their own independent enquiries (due diligence about the title & present condition of the property) assets and claims & dues affecting the property before submission of bids.
5. The bidders may participate in the auction for bidding from their place of choice. Internet connectivity shall have to be ensured by bidder themself. Secured Creditor/Service Provider shall not be held responsible for the internet connectivity, network problems, system crash, power failure etc.
6. For details, help, procedure and online bidding on e-auction prospective bidders may contact the Service Provider M/s. E-Auction Focus (India) Private Limited, Andheri (East), Mumbai - 400059. Email: ramprasad@auctionfocus.net.
7. Participating in the e-auction sale by intending bidders should register their name at https://www.auctionfocus.net in advance and shall log on user id and password. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
8. For participating in e-auction, intending bidders have to deposit a refundable EMD of 10% OF RESERVE PRICE (as mentioned above) to be paid by interested bidders through Demand Draft in favor of "Hiraniandani Financial Services Pvt. Limited".
9. The intending bidders should submit the bid in Bid Form (format available on https://www.auctionfocus.net) along with the Demand Draft (DD) to the Secured Creditor on or before the last date of submission of bid.
10. The successful bidder shall be deemed to have accepted the terms and conditions of the E-Auction Sale Notice and shall be bound by the terms and conditions of the E-Auction Sale Notice.
11. In case of default in payment of above stipulated amounts by the successful bidder/ auction purchaser within the stipulated time, the sale will be cancelled and the amount deposited (including EMD) within 24 hours of the sale, being locked down in his favour and balance 75% of bid amount within 15 days from the date of sale by DD/Pay Order/NEFT/RTGS/Chq favouring Hiraniandani Financial Services Pvt. Limited.
12. In case of default in payment of above stipulated amounts by the successful bidder/ auction purchaser within the stipulated time, the sale will be cancelled and the amount deposited (including EMD) within 24 hours of the sale, being locked down in his favour and balance 75% of bid amount within 15 days from the date of sale by DD/Pay Order/NEFT/RTGS/Chq favouring Hiraniandani Financial Services Pvt. Limited.
13. At the request of the successful bidder, the Authorized Officer in his absolute discretion may grant time in writing, for depositing the balance of the bid amount.
14. The successful Bidder's Bid Price towards TDS (if any) shall be deposited and submitted TDS certificate to the Authorized Officer and the deposit the entire amount of sale price (after deduction of 1% towards TDS), adjusting the EMD to the extent of 5% towards TDS. In case of non-deposit of the sale price within the stipulated time, the EMD shall be forfeited by the Authorized Officer, failing which the earnest deposit will be forfeited.
15. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
16. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
17. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
18. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
19. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
20. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
21. The Authorized Officer may postpone / stamp the E-Auction Sale proceedings without assigning any reason whatsoever. In case the E-Auction Sale proceedings is postponed to a later date before 15 days from the scheduled date of sale, it will be displayed on the website of the service provider.
22. The decision of the Authorized Officer is final, binding and unchallengeable.
23. All bidders are advised to read and understand the terms and conditions of the E-Auction Sale and be bound by them.
24. For further details and queries, contact Authorized Officer, Hiraniandani Financial Services Pvt. Limited Mr. Sandip Thakur - 8189543433 & Mr. Anmol Surdarwar Mo. 9822164539.
25. This publication is also valid only to the Borrower / Mortgagee / Guarantors of the above said loan account pursuant to rule 8 (1) of the Security Interest Act, 2002. The EMD (Earnest Money Deposit) of the successful bidder shall be locked down in his favour. Power failure, etc. on the part of the bidder in such cases. In order to ward off such contingent situation, bidders are requested to make all arrangements in respect of internet connectivity and power supply. It is advised that whatever else is required so that they are able to circumvent such situation and are able to participate in the auction successfully.
26. The successful bidder shall be deemed to have accepted the terms and conditions of the E-Auction Sale Notice and shall be bound by the terms and conditions of the E-Auction Sale Notice.
27. In case of default in payment of above stipulated amounts by the successful bidder/ auction purchaser within the stipulated time, the sale will be cancelled and the amount deposited (including EMD) within 24 hours of the sale, being locked down in his favour and balance 75% of bid amount within 15 days from the date of sale by DD/Pay Order/NEFT/RTGS/Chq favouring Hiraniandani Financial Services Pvt. Limited.
28. In case of default in payment of above stipulated amounts by the successful bidder/ auction purchaser within the stipulated time, the sale will be cancelled and the amount deposited (including EMD) within 24 hours of the sale, being locked down in his favour and balance 75% of bid amount within 15 days from the date of sale by DD/Pay Order/NEFT/RTGS/Chq favouring Hiraniandani Financial Services Pvt. Limited.
29. At the request of the successful bidder, the Authorized Officer in his absolute discretion may grant time in writing, for depositing the balance of the bid amount.
30. The successful Bidder's Bid Price towards TDS (if any) shall be deposited and submitted TDS certificate to the Authorized Officer and the deposit the entire amount of sale price (after deduction of 1% towards TDS), adjusting the EMD to the extent of 5% towards TDS. In case of non-deposit of the sale price within the stipulated time, the EMD shall be forfeited by the Authorized Officer, failing which the earnest deposit will be forfeited.
31. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
32. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
33. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
34. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
35. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
36. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
37. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
38. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
39. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
40. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
41. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
42. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
43. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
44. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
45. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
46. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
47. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
48. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
49. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.
50. Intending bidders are advised to change only the password immediately after logging in to the service provider.

Date: 15.02.2024. Place: Vapi. Authorized Officer

